

**GUJARAT TECHNOLOGICAL UNIVERSITY**

DIPLOMA ENGINEERING – SEMESTER – V (NEW) • EXAMINATION – SUMMER - 2018

**Subject Code: 3350907****Date: 08-May-2018****Subject Name: Electric Traction and Control****Time: 02:30 PM TO 05:00 PM****Total Marks: 70****Instructions:**

1. Attempt all questions.
2. Make Suitable assumptions wherever necessary.
3. Figures to the right indicate full marks.
4. Use of programmable & Communication aids are strictly prohibited.
5. Use of only simple calculator is permitted in Mathematics.
6. English version is authentic.

<b>Q.1</b>	Answer any seven out of ten. દર્શમાંથી કોઈપણ સાતના જવાબ આપો. <span style="float: right;">14</span>
1.	State requirements of an ideal traction system. આદર્શ ટ્રેક્શન સીસ્ટમ માટે ની જરૂરીયાત લખો.
2.	Mention disadvantages of electric traction system. ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન ના ગેર ફાયદા જણાવો.
3.	Define scheduled speed with equation. શેડ્યુઅલ સ્પીડ ની વ્યાખ્યા સુત્ર સાથે આપો.
4.	Explain mechanical characteristics of traction motor. ટ્રેક્શન મોટરની યાંત્રિક લક્ષણો સમજાવો
5.	Explain the function of magnetic light switch. મેન્ઝેટિક લાઇટ સ્વિચ નું કાર્ય સમજાવો.
6.	Explain importance of catenary wire system. કેટેનરી વાયર સીસ્ટમ નું મહત્વ સમજાવો.
7.	Explain the function of auto cut in auto cut out switch. ઓટો કટઇન ઓટો કટઆઉટ સ્વિચ નું કાર્ય સમજાવો.
8.	State high speed trains of the world. દુનિયાની ઉચ્ચ ગતિની ટ્રેનો જણાવો.
9.	Explain Indian track electrification system. ભારતીય ટ્રેક વિદ્યુતીકરણ સીસ્ટમ સમજાવો.
10.	Compare A. C. and D. C. traction system. એ.સી. અને ડી.સી. ટ્રેક્શન સીસ્ટમ ની સરખામણી કરો.
<b>Q.2</b>	(a) Explain electrical characteristics of traction motor. <span style="float: right;">03</span>
પ્રશ્ન. 2	(અ) ટ્રેક્શન મોટર ની વિદ્યુત લક્ષણો સમજાવો <span style="float: right;">03</span>
	OR
	(a) Explain characteristics of A.C. series motor. <span style="float: right;">03</span>
	(અ) એ. સી. સીરીઝ મોટરની લાક્ષણીકતા સમજાવો. <span style="float: right;">03</span>
	(b) Draw the speed time curve for all type of traction services. <span style="float: right;">03</span>
	(બ) બધા પ્રકારની ટ્રેક્શન સર્વિસ માટે સ્પીડ-ગાઇડ કર્વ દોરો. <span style="float: right;">03</span>

	OR	
(b)	Explain working principle of monorail and metro system of traction.	03
(બુ)	કાર્ય સિધ્યાંત સમજાવો : ટ્રેક્શન માટે ની મોનો રેઇલ અને મેટ્રો સિસ્ટમ.	03
(c)	State advantages of electric traction system.	04
(ક)	ઇલેક્ટ્રોનિક ટ્રેક્શન ના ફાયદાઓ જણાવો.	04
	OR	
(c)	Explain principle of Magnetic levitation.	04
(ક)	મેન્ઝેટિક લેવીટેશન નો સિધ્યાંત સમજાવો.	04
(d)	Derive equation for maximum speed.	04
(સ)	મહત્તમ ગતિ માટેનું સુત્ર મેળવો.	04
	OR	
(d)	Explain factors affecting scheduled speed of train.	04
(સ)	ટ્રેન ની શિડ્યુલ સ્પીડ ને અસરકર્તા પરિબળો સમજાવો.	04
<b>Q.3</b>	(a) Explain multiple unit control.	03
<b>પ્રશ્ન. 3</b>	(અ) મલ્ટીપલ યુનિટ નિયત્રણ સમજાવો.	03
	OR	
(a)	Explain Metadyne control.	03
(અ)	મેટાડાઇન નિયત્રણ સમજાવો.	03
(b)	Explain working principle of Linear induction motor.	03
(બુ)	લિનીયર ઇન્ડક્શન મોટર નો કાર્ય સિધ્યાંત સમજાવો.	03
	OR	
(b)	Why D.C. series motor is best suited as traction motor?	03
(બુ)	શા માટે ટ્રેક્શન મોટર તરીકે ડી.સી.સીરીઝ મોટર ઉત્તમ છે?	03
(c)	Explain working principle of Rosenberg Generator.	04
(ક)	રોઝનબર્ગ જનરેટર નો કાર્ય સિધ્યાંત સમજાવો.	04
	OR	
(c)	Derive the expression for tractive effort.	04
(ક)	ટ્રેક્ટીલ એફોર્ચ માટેનું સુત્ર મેળવો.	04
(d)	Explain the working principle of Pulse width modulation control.	04
(સ)	પલ્સ વીડ્યુલ મોડ્યુલેશન કંટ્રોલ નો કાર્ય સિધ્યાંત સમજાવો.	04
	OR	
(d)	Explain starting series parallel control for two D.C. series motor with diagram.	04
(સ)	બે ડી. સી. સીરીઝ મોટરોનાં શ્રેણી-સમાંતર નિયંત્રણ આકૃતિ આપી સમજાવો.	04
<b>Q.4</b>	(a) State merits and demerits of regenerative breaking.	03
<b>પ્રશ્ન. 4</b>	(અ) પુનર્જનનીય બ્રેકિંગનાં ફાયદા અને ગેરફાયદાઓ લખો.	03
	OR	
(a)	Explain plugging method in D. C. series motor.	03
(અ)	ડી. સી. સીરીઝ મોટરમાં પ્લગિંગ પદ્ધતિ સમજાવો.	03
(b)	Explain single battery system with diagram.	04
(બુ)	સિંગલ બેટરી પદ્ધતિ ડાયાગ્રામ સાથે સમજાવો.	04
	OR	
(b)	Explain pantograph collector with diagram.	04

- (b) પેન્ટોગ્રાફ કલેક્ટર ડાયાગ્રામ સાથે સમજાવો. 04
- (c) Draw diagram of composite locomotive and explain functions of main equipments used in it. 07
- (d) કોમ્પોઝીટ લોકોમોટીવ નો ડાયાગ્રામ દોરો અને તેમાં વપરાતા મુખ્ય સાધનો નું કાર્ય સમજાવો. 07
- Q.5** (a) Explain feeding post for electrical traction system with diagram. 04
- પ્રશ્ન. ૫** (અ) વિદ્યુત ટ્રેક્શન સીસ્ટમ માટે ડાયાગ્રામ સાથે ફીડિંગ પોસ્ટ સમજાવો. 04
- (b) Explain bridge transition with circuit diagram. 04
- (બ) સરકીટ ડાયાગ્રામ સાથે બ્રિજ સંકમણ સમજાવો. 04
- (c) List and explain the major equipments of A. C. traction substation. 03
- (ક) એ. સી. ટ્રેક્શન સબ-સ્ટેશન માટેની મુખ્ય ઉપકરણો લખો અને સમજાવો. 03
- (d) If  $T = 160 \text{ sec}$ ,  $\alpha = 2 \text{ Km/hr/sec}$  and  $\beta = 3 \text{ Km/hr/sec}$ ,  $D = 1.6 \text{ km}$ , find  $V_m$ . 03
- (સ) જો  $T = 160 \text{ sec}$  અને  $\alpha = 2 \text{ Km/hr/sec}$  અને  $\beta = 3 \text{ Km/hr/sec}$ ,  $D = 1.6 \text{ km}$  હોયતો  $V_m$  શોધો.

\*\*\*\*\*